

PNB MetLife India Insurance Company Limited,
Registered office: Unit No. 701, 702 & 703, 7th Floor, West Wing, Raheja Towers, 26/27 M G Road, Bangalore -560001 Karnataka. IRDA of India Registration number 117. CI No. U66010KA2001PLC028883,
Call us Toll-free at 1-800-425-6969, Website: www.pnbmetLife.com, Email: indiaservice@pnbmetLife.com, or write to us at 1st Floor, Techniplex -1, Techniplex Complex,
Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400062. Phone: +91-22-41790000, Fax: +91-22-41790203

પીએનબી મેટ-લાઈફ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ, રજેસ્ટર્ડ ઓફિસ : યુનિટ નં. ૭૦૧,૭૦૨ અને ૭૦૩, સાતમો માળ, વેસ્ટ વિંગ, રાફેજા ટાવર્સ, ૧૬/૧૭ એમ જી રીડ , બેંગલીર – ૫૬૦ ૦૦૧. કણીટક,આઈઆરડીએ ઑફ ઈન્ડિયા રેજિસ્ટ્રેશન નં. ૧૧૭. સી આઈ નં. ∪66010KA2001PLC028883, ટોલ ફ્રી નં . ૧-૮૦૦-૪૨૫-૬૯૬૯ ઉપર કોલ કરો , વેબ સાઇટ <u>www.pnbmetlife.com,</u> ઇ-મેઈલ : <u>indiaservice@pnbmetlife.co.in</u> અથવા અમને લખો - ૧લો માળ, ટેકનીપ્લેક્સ કોમ્પ્લેક્ષ વીર સાવરકર ફ્લાય ઓવેર બહાર, ગોરેગાવ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૬૨ ફ્રીન નં. +૯૧-૨૨-૪૧૭૯૦૦૦૦, ફેક્ષ +૯૧-૨૨-૪૧૭૯૦૨૦૩.

Vesting Benefit Request Form વેસ્ટિંગ બેનિફિટ રિકવેસ્ટ ફોર્મ

| Mandatory Fields (Annuitant Details) ફરજિયાત વિભાગો (એન્યુટન્ટ વિગતો) | |
|--|--|
| Policy Number: પોલિસી નંબર: | Vesting Date: વેસ્ટિંગ ડેટ: |
| Policy holders Name: પોલિસી ધારકનું નામ: | |
| | Please paste recent cofour photograph |
| PAN#: (Self-attested PAN copy to be submitted with PAN details) PAN# (PANની વિગતો સાથે સેલ્ક-એટેસ્ટેડ PAN નકલ દાખલ કરવી): | કૃધા કરી તાજેતરનો રંગીન કોટોગ્રાફ ચોંટાડી |
| Nationality: (Only applicable for Non-Indian citizens) | |
| Address including PIN Code: (Kindly update your latest contact details along with a valid address proof document to facilita પિન કોડ સહિત સરનામુ: (ઝડપી કાર્યવાહીમાં સરળતા માટે કૃપા કરી તમારા તાજેતરના સંપર્કની વિગતો સરનામાના માન્ય પુરાવા સાથે | |
| | |
| Contact Number: (Mandatory) \$\frac{1}{2}\text{Fright}^2 \text{St}^2 \text{Figs.} | E STDOFFICE |
| (ફરિજયાત): E-Mail ID: | |
| ઇ-મેઇલ આઇડી: | |
| Please tick ($$) anyone of the options below: કૃપા કરી નીચેના વિકલ્પોમાંથી કોઇ એક પર ($$) કરો: | |
| લાભની સંપૂર્ણ ૨કમ માટે હું અન્યુઇટી ખરીદવા ઇચ્છુ છું allowed) and to utilize the balance | as lumpsump (maximum 33.33% of the maturity amount maturity (the Purchase price) towards purchase of annuity ત્રામ 33.33%ની છૂટ છે) પ્રાપ્ત કરવા અને બાકીની મેચ્યુરિટી કરવા ઇચ્છું છું. |
| If II option selected then option to be given as mention below (minimum of Rs 5000 as per eligibility) ઇજો વિકલ્પ II પસંદ કરવામાં આવે છે તો નીચે દર્શાવ્યા મુજબ વિકલ્પ (પાત્રતા અનુસાર ન્યૂનતમ રૂ .5000) આપવામાં આવે છે | |
| a) 33.33% b)<33.33% (| 6 દર્શાવો |
| III. I wish to Purchase Annuity from PNB MetLife Life Insurance Company | |
| If 'No' is selected above, please share the name of the Insurance Company from whom Annuity is being purchased: જો ઉપર વિકલ્પ 'ના' પસંદ કરવામાં આવેલ છે, તો કૃપા કરી જેની પાસેથી એન્યુઇટી ખરીદાઇ રહી છે તે કંપનીનું નામ જણાવો: | |
| If 'Yes' is selected, please share PNB MetLife application number to which the annuity amount has to be transferred: જો 'હા' પસંદ કરવામાં આવેલ છે, તો કૃપા કરી જેને એન્યુઇટીની રકમ ટ્રાન્સફર કરવાની છે તે પીએનબી મેટલાઇફ આવેદન ક્રમાંક જણ | ાવો: |
| Purchase Price for Annuity Rs એન્યુઇટી માટેની ખરીદ કિંમત રૂ. | |
| Payment Details for Lumpsum Amount (if applicable) ઉચ્ચક ૨કમ માટેની ચૂકવણીની વિગતો (જો લાગુ પડતું હોય તો) | |
| Bank Name*: | |
| Account Number: ખાતા ક્રમાંક: | |
| | NRE customer, please provide the Customer Declaration – |
| કૃપા કરી કોઇક એક બેન્ક ખાતા પ્રકારને ચિલ્ન (√)*: બચત | n Request & bank certificate for Repatriation) ક્ના કિસ્સામાં કૃપા કરી ડિક્લેરેશન - રિપેટ્રિએશન માટે રિકવેસ્ટ અને બેન્ક સર્ટિફિકેટ પૂરા પાડો) |

| Original Policy Document ઓરિશ્વિનલ પોલિસી ડોકયુમેન્ટ: | Self-attested address and સરનામા અને ઓળખનો ર | • |
|---|---|--|
| Original Cancelled Personalized cheque કેન્સલ કરેલો ઓરિજિનલ પર્સનાલાઇઝડ ચેક | OR અથવા, Self-attested copy of ba જો પર્સનાલાઇઝડ ચેક સંલ | nk statement/ pass book copy, if personalized cheque is not attached*. ગ્ન નથી, તો બેન્ક સ્ટેટમેન્ટની નકલ/પાસ બુકની સેલ્ફ-એટેસ્ટેડ નકલ*. |
| (i.e. cheque bearing printed A/C number and name c (એટલે કે છાપેલા ખાતા ક્રમાંક અને ખાતાધારકનું નામ ધ | of A/C holder on it)* રાવનાર ચેક)* | |
| liabilities in relation to the above claim upon the payment submitted by me. હું (ર | of the claims money. I also agree and will not hold PNB M બેન્યુઇટન્ટ/લાભાર્થીનું નામ) સમજું અને સંમત થાઉં છું કે દાવાન | at PNB MetLife India Insurance Company shall be discharged of all letLife responsible for any delay in case of any incomplete information તા નાણાંની ચૂકવણી ઉપરાંત પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને માં આવેલી કોઇક અપૂર્ણ માહિતીને લીધે કોઇક વિલંબના કિસ્સામાં પીએનબી |
| Signature of Policy Owner/Assignor | Plac સ્થ Signature of Assignee | e: Date; ન: તારીખ: |
| orginature of forcy Owner/Assignor In case of the policy being conditionally assigned**, request should be signed both by the Assignee & Assigno પોલિસી ઓનર/અસાઇનરની સહિ | In case of the policy being absolutely assigned, | (**Assignor signature would not be required in case of conditional assignment done to secure a loan) |
| પાલસા આન્ય;અસાઇન્યના સાહ પોલિસી સશર્ત સોંપવામાં આવવાના કિસ્સામાં!**, અસાઇની અને અસાઇનર બન્ને દ્વારા વિનંતી પર સહિ કરવામાં આવવી જોઇએ | અસાઝનાના સાહ પોલિસી પ્રતિબંધ રહિત સોંપવામાં આવવાના કિસ્સામાં, વિનંતી પર માત્ર કરવામાં આવવી જોઇએ | (**લોન સિકયોર કરવા સશર્ત સોંપણી થઇ હોય તો તેવા કિસ્સામાં અસાઇનરની સહિની આવશ્યક્તા નહ હોય) |
| Note: Purchase Price is based on the NAV on maturity date નોંધ: ખરીદ કિંમત પાકતી તારીખે NAV ના આધારે હોય છે. |). | |
| reasury. A TDS certificate would be issued to you within the income tax regulations and therefore, we request you umendments made thereto from time to time. #2014 દ્વારા પ્રસ્તુત અને 1 લી ઓક્ટોબર 2014થી અમલમાં અ ઝૂટ મેળવનાર ન હોય, તો એક નાણાં કીય વર્ષમાં INR 99,999 મુમ્યરેખામાં એક TDS સર્ટિફિકેટ તમને જારી કરવામાં આવશે. | he stipulated timelines. În case your PAN is not registered to submit a copy of your PAN in case of it not being sub ાવના૨ ફાઇનાન્સ એકટના ઇન્કમ ટેક્સ એકટના સેક્શન 194D કરતાં વધારેની પેઆઉટ ૨કમ પર 2% ના બરોબર ૨કમ સોર્સમ જો પીએનબી મેટલાઇફ સાથે તમારું PAN રજિસ્ટર્ડ નથી, તો | ould be deducted at source and deposited into the Central Government with PNB MetLife, a higher rate of TDS (20%) will be applicable as per mitted earlier. Tax is as per the Income Tax Act, 1961 & subject to any A અનુસાર, જો તમારી પોલિસી ઇન્કમ ટેક્સ એકટના સેક્શન 10 (10D) હેઠળ ાંથી બાદ કરવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ટ્રેઝરીમાં જમા કરવામાં આવશે. નિશ્ચિત તેવા કિસ્સામાં, ઇન્કમ ટેક્સના કાનૂનો પ્રમાણે TDS (20%) ના ઊંચા દરે લાગુ ધનેતી કરીએ છીએ. ટેક્સ ઇન્કમ ટેક્સ એકટ, 1961 અનુસાર અને તેમાં વખતો |
| | A GLOVING IN LEDNING THE REAL PROPERTY OF A DECIDENCE | |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per | the information provided by the applicant. I also certify t | માટે ઘોષણા & he/she has hat Mr./Mrs |
| hereby declare that I have read out the contents of th understood the same and replies has been recorded as per nas signed/affixed his/her thumb impression/signature in nerein is true & correct to the best of my knowledge & beli હું આ સાથે ધોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને દૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અ | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગ્રઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને તાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી | માટે થોષણા & he/she has |
| I hereby declare that I have read out the contents of th understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અ વર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગ્રઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને તાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated વાંચી સંભળાવેલ છે અને તે/તેણીએ આને સમજી લીધેલ છે અને આવેદક દ્વારા એ મેં ઉપરોક્ત વિષયવસ્તુ તેમને/તેણીને |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અંName: | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગૃઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગૃઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ગુઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ resonnel | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated વાંચી સંભળાવેલ છે અને તે/તેણીએ આને સમજી લીધેલ છે અને આવેદક દ્વારા એ મેં ઉપરોક્ત વિષયવસ્તુ તેમને/તેણીને જણાવ્યું છે તે મારી જાણકારી અને માન્યતા અનુસાર સત્ય અને સાચું છે Signature of Declarant ઘોષણા કરનારની સહિ Customer Representative Bank Courier |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગૃઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ sonnel િ Specified Person (SP) િ Customer હ્ય સ્પેસિફાઇડ પર્સન (એસપી) કસ્ટમર r authorization letter for submission of request and a Self- લ કરવા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન લે riginal content in English along with its vernacular the English version shall be considered as final and | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: ———————————————————————————————————— | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગૃઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ sonnel િ Specified Person (SP) િ Customer હ્ય સ્પેસિફાઇડ પર્સન (એસપી) કસ્ટમર r authorization letter for submission of request and a Self- લ કરવા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન લે riginal content in English along with its vernacular the English version shall be considered as final and | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: ———————————————————————————————————— | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગુઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરી હતાનું સ્થિત હતાનું સ્થિત હતાનું સ્થિત અનુવાદિત અ | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: ———————————————————————————————————— | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગુઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરી હતાનું સ્થિત હતાનું સ્થિત હતાનું સ્થિત અનુવાદિત અ | માટે થોષણા & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated વાંચી સંભળાવેલ છે અને તે/તેણીએ આને સમજી લીધેલ છે અને આવેદક દ્વારા એ મેં ઉપરોક્ત વિષયવસ્તુ તેમને/તેણીને જણાવ્યું છે તે મારી જાણકારી અને માન્યતા અનુસાર સત્ય અને સાચું છે Signature of Declarant |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: ———————————————————————————————————— | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગુઠાનું નિશાન કરેલ છે. હું ધોષણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ sonnel | hat Mr./Mrs & he/she has hat Mr./Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated વાંચી સંભળાવેલ છે અને તે/તેણીએ આને સમજી લીધેલ છે અને આવેદક દ્વારા એ મેં ઉપરોક્ત વિષયવસ્તુ તેમને/તેણીને જણાવ્યું છે તે મારી જાણકારી અને માન્યતા અનુસાર સત્ય અને સાચું છે. Signature of Declarant ઘોષણા કરનારની સહિ Customer Representative Bank Courier કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ બેન્ક કૂરીયર તરફથી Attested ID proof of the authorized representative to be submitted along હૃદર અને અધિકૃત પ્રતિનિધિનું સેલ્ક-એટેસ્ટેડ આઇડી પ્રુફ આ વિનંતી સાથે translations. In the event of any disagreement arising between dishall prevail. |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie is at a live of the latter of the present of the person of the present of the person of the present of the person of | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગુઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરી હતા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન હે કરવા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન હે riginal content in English along with its vernacular the English version shall be considered as final and સ્થુલર અનુવાદો સહિત અંગ્રેજીમાં ધરાવે છે. અનુવાદિત આવૃત્તિ સ્થિય અનુવાદો સહિત અંગ્રેજીમાં ધરાવે છે. અનુવાદિત આવૃત્તિ સ્થિય કર્યાલેજમેન્ટ સ્થિપ against P | માટે થોષણા & he/she has hat Mr/Mrs ed the above contents to him/her. I declare that whatever I have stated |
| I hereby declare that I have read out the contents of the understood the same and replies has been recorded as per has signed/affixed his/her thumb impression/signature in herein is true & correct to the best of my knowledge & belie હું આ સાથે ઘોષણા કરું છું કે મેં આવેદન પત્રકના વિષયવસ્તુઓને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર જવાબો નોંધી લેવામાં અવર્ણન કર્યા પછી મારી ઉપસ્થિતિમાં સ્થાનિક ભાષામાં સહિ કરી/અં Name: | સ્થાનિક ભાષામાં સહિ કરવા અથવા અંગુઠાનું નિશાન પાડવા ne Application form to Mr./Ms./Mrs. the information provided by the applicant. I also certify to vernacular language in my presence after I have explain ef. શ્રી/શ્રીમતિ/સુશ્રીને ાવેલ છે. હું એ પણ પ્રમાણિત કરું છું કે શ્રી/શ્રીમતિ/સુશ્રી ાગુઠાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરેલ છે. હું ધોપણા કરું છું કે અહીં મેં જે કોઇ પણ કરાનું નિશાન કરી હતા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન હે કરવા માટે વધુ કાર્યવાહી હેતુ કસ્ટમર ઓથોરાઇઝેશન હે riginal content in English along with its vernacular the English version shall be considered as final and સ્થુલર અનુવાદો સહિત અંગ્રેજીમાં ધરાવે છે. અનુવાદિત આવૃત્તિ સ્થિય અનુવાદો સહિત અંગ્રેજીમાં ધરાવે છે. અનુવાદિત આવૃત્તિ સ્થિય કર્યાલેજમેન્ટ સ્થિપ against P | hat Mr./Mrs |